



ત્વરિત જાહેરાત માટે

અપડેટ 3: સિટી ઓફ બ્રેમ્પટન COVID-19 સામે આરોગ્ય અને સલામતીના વધારાના પગલાં લઈ રહ્યા છે – સિટી હોલ અને જાહેર સવલતો બંધ કરવામાં આવી છે, ઈવેન્ટ્સ અને પ્રોગ્રામિંગ રદ કરવામાં આવ્યા છે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (13 માર્ચ 2020) – આજની પીલ પબ્લિક હેલ્થની જાહેરાતને પગલે પીલના રક્ષણાર્થે COVID-19 અંગેની લેવાજોગ વધારાની સાવચેતીઓ તરીકે સિટી ઓફ બ્રેમ્પટન દ્વારા આપણા સમુદાયના આરોગ્ય અને સુખાકારીને રક્ષણ આપવામાં મદદ મળે તે ઈરાદે સર્વિસિસ અને પ્રોગ્રામિંગમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે.

સિટી દ્વારા ચલાવાતા ઈવેન્ટ્સ

તમામ સિટી દ્વારા ચલાવાતા ઈવેન્ટ્સ જે માર્ચની 14મી થી એપ્રિલ 5 વચ્ચે ગોઠવાયા હતાં તે રદ કરવામાં આવે છે. સિટીની સવલતોમાં પણ આ સમયગાળામાં યોજાયેલ તમામ સામાજિક પ્રસંગો રદ કરવામાં આવે છે.

રિક્કોનેક્શન પ્રોગ્રામિંગ અને માર્ચ બ્રેક કેમ્પ્સ

સોમવારથી અમલી બને તે રીતે માર્ચ 16મીનો માર્ચ બ્રેક પ્રોગ્રામિંગ રદ કરવામાં આવે છે. ઉપરાંત, માર્ચ 16 થી એપ્રિલ 5 સુધીના રિક્કોનેક્શન પ્રોગ્રામિંગ રદ કરવામાં આવે છે. સંપૂર્ણ રિક્કોનેક્શન પૂરા પાડવામાં આવશે. કૃપા કરી વધુ માહિતી માટે reconnects@brampton.caનો સંપર્ક કરો.

સિટી-સવલતો બંધ કરવા બાબતે

COVID-19નો પ્રસાર થતો રોકવા માટે સિટી હોલ, રિક્કોનેક્શન અને કમ્યુનિટી સેન્ટરો, પર્ફોમિંગ આર્ટ્સ વેન્યુ અને બ્રેમ્પટન પુસ્તકાલયોની શાખાઓ સહિત સિટીની તમામ સવલતો માર્ચ 16થી એપ્રિલ 5ના દિન સહિત બંધ રહેશે.

કાઉન્સિલની સભાઓ

માર્ચ 16થી એપ્રિલ 5ના દિન સહિત અમલ, સિટી કાઉન્સિલ, કમિટી ઓફ કાઉન્સિલ અને કમિટી ઓફ એડજસ્ટમેન્ટની તમામ સભાઓ રદ કરવામાં આવી છે.



દ રોજ બ્રેમ્પટન

માર્ચ 16થી અમલ રહીને 05 એપ્રિલ 2020 સુધી દ રોજ બ્રેમ્પટન સહિત સિટી ઓફ બ્રેમ્પટન પરફોર્મિંગ આર્ટ્સ વેન્યુમાં પૂર્વ નિર્ધારિત તમામ ઈવેન્ટ્સ રદ અથવા મુલતવી કરવામાં આવેલ છે. જાહેર જનતા માટે પરફોર્મિંગ આર્ટ્સ વેન્યુ 05 એપ્રિલ 2020 સુધી બંધ રહેશે.

વધુ માહિતી માટે કૃપા કરીને કામકાજના કલાકો દરમિયાન (સોમવારથી શનિવાર, સવારે 10 થી સાંજે 6) દ રોજ બ્રેમ્પટન-સ ઓફિસ ઓફિસનો સંપર્ક 905 874 2800 એક્સ્ટે. 62803 અને 62804 પર, અથવા ઈમેલ boxoffice@brampton.ca પર કરશો.

અતિમહત્વપૂર્ણ સેવાઓ

તમામ અતિમહત્વપૂર્ણ સેવાઓ આપણા સમાજને મદદરૂપ થવા સામાન્ય રીતે કાર્ય કરશે જેમાં સામેલ છે ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ, બાય-લો એન્ફોર્સમેન્ટ, માર્ગ પ્રચાલન, સિક્યોરિટી સર્વિસિસ, પ્રાણીઓની સેવાઓ અને POA કોર્ટ્સ.

આપણા અને કર્મચારીઓના આરોગ્યનું રક્ષણ કરવા માટે સિટીએ બસોમાં, સવલતોમાં અને ટર્મિનલોમાં કઠણ સપાટીઓ અને બેઠકોને સાફ કરવાના અને જંતુમુક્ત કરવાના આવર્તનોમાં વધારો કરા્યો છે.

ઈમર્જન્સી ઓપરેશન્સ સેન્ટર – સિટી ઓફ બ્રેમ્પટન ઈમર્જન્સી રિસ્પોન્સ પ્લાન સક્રિય કરવામાં આવેલ છે

સિટી ઓફ બ્રેમ્પટન પીલ પબ્લિક હેલ્થની સલાહ અને સૂચનાને અનુસરે છે. સિટીએ જ્યારે હજુ સુધી COVID-19 પર સત્તાવાર કટોકટી જાહેર કરી નથી પરંતુ બ્રેમ્પટનની ઈમર્જન્સી મેનેજમેન્ટ ઓફિસ દ્વારા *સિટી ઓફ બ્રેમ્પટન ઈમર્જન્સી રિસ્પોન્સ પ્લાન* લેવેલ -2 પર સક્રિય કરવામાં આવેલ છે. આ નિર્ણયથી નિવારણ અને રોકથામ માટેના સ્ત્રોતો સમર્પિત કરવામાં વધુ ઝડપી પ્રતિભાવ આપવામાં મદદ મળશે.

COVID-19 અસેસમેન્ટ સેન્ટર – પીલ મેમોરિયલ

પીલ મેમોરિયલ સેન્ટર ફોર ઈન્ટિગ્રેટેડ હેલ્થ એન્ડ વેલનેસ (Peel Memorial Centre for Integrated Health and Wellness) ખાતે વિલિયમ ઓસ્લર હેલ્થ સિસ્ટમે (William Osler Health System) COVID-19 અસેસમેન્ટ સેન્ટર ખુલ્લુ મુક્યું છે જેથી આપના સમુદાયના લોકોની તપાસ અને પરીક્ષણ થઈ શકે જેઓ COVID-19ના સંભવિત લક્ષણો અનુભવતા હોય. ઓસ્લર અસેસમેન્ટ સેન્ટર (Osler Assessment Centre) વોક-ઇન ક્લિનિક નથી. અસેસમેન્ટ સેન્ટરના કામકાજના કલાકો બપોરે 2 થી સાંજે 8 વાગ્યા સુધી, અઠવાડિયાના સાત દિવસના છે. આ સવલત એક આત્મનિર્ભર ક્ષેત્રમાં પીલ મેમોરિયલ ખાતે સ્થિત છે અને તે સાઈટ પર અર્જન્ટ કેર સેન્ટર અથવા આઉટપેશન્ટ સર્વિસિસમાં હાજર રહેલ અન્ય દર્દીઓને પ્રભાવિત કરતું નથી. ઓસ્લર કાળજી મેળવવાની સલામત જગ્યા છે.



સિટીના ઈવેન્ટ્સ અને પ્રોગ્રામિંગ માટે, લોકોને નીચે આપેલ બાબતો અનુસરવાનું આલ્વાન કરવામાં આવે છે [પીલ પબ્લિક હેલ્થની ભલામણ કરેલ સ્વચ્છતાની પ્રણાલિઓ](#):

- જો તમને [સ્વ-ટેપરેબ](#) રાખવા જણાવાયું હોય, તો કૃપા કરીને તમારા આરોગ્ય સંભાળ પ્રદાતાની સલાહ અનુસરશો.
- વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોતા રહેશો અથવા અલ્કોહોલ ધરાવતું હેન્ડ-સેનિટાઇઝર વાપરો.
- તમારી આંખો, મોં, અને નાકને સંભવ હોય એટલું સ્પર્શ કરવું ટાળો.
- જે લોકો બિમાર હોય તેમને અને તેમની વસ્તુઓ સાથેનો સંપર્ક ટાળો.
- પોતાની ખાંસી અને છીંકને ટિશ્યુથી ઢાંકો. જો તમારી પાસે ટિશ્યુ ન હોય, તો તમારી બાંધના ઉપલા ભાગ અથવા કોણી પર છીંક ખાઓ, હાથમાં નહીં. ખાંસી કે છીંક ખાધા બાદ હાથ ધુઓ.
- નિરોગી જીવનશૈલી જાળવો, જેમાં સામેલ છે આરોગ્યપ્રદ આહાર, વ્યાયામ અને પૂરતી ઉંઘ જેથી શરીરની ઈમ્યુન સિસ્ટમ મજબૂત બને.
- ફ્લુનો શોટ લેશો. તમને COVID-19 થાય તેના કરતા વધુ સંભાવના ઈન્ફ્લુએન્ઝા થવાની છે અને બિમાર થવાથી અન્ય સુક્ષ્મજંતુઓ સામે તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે.
- જો તમારે પોતાને અળગા રહેવાની આવશ્યકતા હોય, તો કૃપા કરીને તમારા આરોગ્ય સંભાળ પ્રદાતાની સલાહ અનુસરશો.

સિટી ઓફ બ્રેમ્પટન COVID-19 ને ગંભીરતાથી ધ્યાન પર લે છે અને પીલ પબ્લિક હેલ્થની સલાહ અનુસરવાનું ચાલુ રાખે છે. સૌથી અદ્યતન માહિતી અહીં ઉપલબ્ધ છે www.peelregion.ca/coronavirus.

મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown)નો સંદેશ

"સિટી ઓફ બ્રેમ્પટન સેવા અને સુવિધાઓને બંધ કરવા અને COVID-19 ના પ્રસારને મર્યાદિત કરવા માટે ઈવેન્ટ્સ અને પ્રોગ્રામિંગ મુલતવી રાખવા માટેના વધારાના પગલાઓ લઈ રહ્યા છે. આ મહત્વપૂર્ણ પગલાં બ્રેમ્પટનવાસીઓની સલામતી અને આરોગ્યને સુરક્ષિત કરશે. આ બંધનો રહેવાસીઓ પર પડેલો પ્રભાવ અમે જાણીએ છીએ અને અમે આ વિકસતી પરિસ્થિતિને સતત મૂલવી રહ્યા છીએ તેમજ પ્રતિસાદ આપી રહ્યા છીએ. અમે રહેવાસીઓને ભલામણ કરેલ સ્વચ્છતા પ્રણાલિઓનું પાલન કરવા અને બ્રેમ્પટન ટ્રાન્ઝિટનો બિનજરૂરી ઉપયોગ ન કરવા પ્રોત્સાહિત કરીએ છીએ."

વધુ જાણકારી:

- [સિટી ઓફ બ્રેમ્પટન COVID-19](#)
- [અપડેટ 2: સિટી ઓફ બ્રેમ્પટનનાં COVID-19 સામે આરોગ્ય અને સલામતીના વધારાના પગલાં લઈ રહ્યા છે](#)
- [પીલ પબ્લિક હેલ્થ – નોવેલ કોરોનાવાયરસ \(COVID-19\)](#)



- [सीटी ओफ़ ब्रैम्पटन – सर्विस माडिती अपडेट 1](#)
- [पील मेमोरियल सेंटर फ़ोर इन्टिग्रेटेड हेल्थ ऐन्ड वेलनेस आने COVID-19 असेसमेन्ट सेंटर](#)
- [प्रोविन्स ओफ़ ओन्टारियो: आरोग्य मंत्रालय – नोवेल कोरोनावायरस \(COVID-19\)](#)
- [गवर्न्मेन्ट ओफ़ कॅनेडा- कोरोनावायरस \(COVID-19\) अपडेट](#)
- [वर्ल्ड हेल्थ ऑर्गनाईजेशन – कोरोनावायरस \(COVID-19\) अपडेट](#)

-30-

मिडिया संपर्क:

मोनिका दुग्गल

कोऑर्डिनेटर, मिडिया ऐन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूहात्मक संवाद

सीटी ओफ़ ब्रैम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca



BRAMPTON

Service and Information Update

